

M.A. (ECONOMICS) Semester - 4 (CBCS) Examination
March/April - 2026 (As Per Syllabus Year June-2019)
Agriculture Economics - 2(Elective-1)

Time: 2:30 Hours

Marks:70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	નરેગા (નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ) અંગે સમજૂતી આપી તેના લક્ષણો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૧	ખેત મજૂરનો અર્થ સમજાવી તેની આર્થિક સ્થિતિ સુધારવાનાં પગલાંઓ જણાવો.	
પ્રશ્ન-૨	ભારતમાં ખેત ધિરાણમાં નાબાર્ડ (NABARD) ની ભૂમિકા અને મર્યાદાઓ જણાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૨	પ્રાદેશિક ગ્રામીણ બેંક (RRB)ના કાર્યો અને મર્યાદાઓ વર્ણવો.	
પ્રશ્ન-૩	ભારતમાં ખેત પેદાશની વેચાણ વ્યવસ્થા સમજાવી તેની ખામીઓ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૩	ખેત ભાવ નીતિ ની સમજૂતી આપી તેના હેતુઓ સમજાવો.	
પ્રશ્ન-૪	વૈશ્વિકીકરણ અને WTO ની ભારતીય કૃષિ ક્ષેત્ર ઉપર ની અસરો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૪	વ્યાપારની શરતો એટલે શું? કૃષિ ક્ષેત્રની તરફેણની વ્યાપારની શરતોની દલિલો સમજાવો.	
પ્રશ્ન-૫	કોઈપણ બે પ્રશ્નના જવાબ આપો.	(૧૪)
	1) નરેગા (નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ) ના બોધપાઠ સમજાવો.	
	2) ગ્રામીણ ધિરાણ સામેના પડકારો કયા છે?	
	3) કૃષિ ભાવનીતિ માટે નાં પરિબળો સમજાવો.	
	4) વિશ્વ ખાદ્ય સહાય	

ENGLISH VERSION

Que.1	Explain about NAREGA (National Rural Employment Guarantee Programmed) and Explain its Characteristics.	(14)
	OR	
Que.1	Explain the meaning of agriculture labor and stapes to improve their economic condition.	
Que.2	Explain the Role and limitations of NABARD in agriculture finance.	(14)
	OR	
Que.2	Describe the functions and limitations of Regional Rural Bank (RRB).	
Que.3	Explain the agricultural products selling system and its defects in India.	(14)
	OR	
Que.3	Explain the agriculture price policy and its objectives in India.	
Que.4	Explain the impacts of Globalization and WTO on Indian agriculture sector.	(14)
	OR	
Que.4	What is term of trade? Explain arguments of in favor term of Tred to Agriculture sector.	
Que.5	Give the answer of Any Two for below:	(14)
	1) Explain the Lessons of NAREGA (National Rural Employment Guarantee Programmed).	
	2) Which are the challenges of rural Finance?	
	3) Explain the tools for agriculture price policy.	
	4) World Food Assistance.	
